



સંયુક્ત ખાતાના મામલામાં ભાગ-૧ (સી.આઈ.એફ. સીટ) દરેક ગ્રાહક માટે



एक परिवार एक बैंक

[illegible]

૦૩ ઓળખપત્રનું પ્રમાણ (સરનામું પુરું કોઈ એક આઈ.ડી. પ્રકાર પર ટિક કરો)

☐ પાસપોર્ટ	☐ મતદાતા ઓળખ કાર્ડ	☐ ડ્રાઈવિંગ લાયન્સસ	☐ યુ.આઈ.ડી.	☐ કોઈ અન્ય
☐ નરેગા જોબ કાર્ડ	☐ રાષ્ટ્રીય જનગણના રજિસ્ટર (આધાર) દ્વારા પ્રકાશિત નામ / સરનામા			
ખાતા દસ્તાવેજ (કોડ)				

દસ્તાવેજ કોડ	વિવરણ
૦૧	
૦૨	

દસ્તાવેજ ક્રમાંક / ઓળખ ક્રમાંક

પ્રસ્તુત કર્યાની તારીખ સમાપ્તિની તારીખ (લાગુ હોય તો)

૦૪ એડ્રેસ વિવરણ : ☐ વર્તમાન ☐ સ્થાયી ☐ વિદેશ

એડ્રેસનું પ્રકાર ☐ રહેઠાણ ☐ વ્યવસાય ☐ પંજીકૃત કાર્યાલય ☐ અન્ય

સરનામું

શહેર/ગામ જિલ્લા

રાજ્ય પિન આય.એસ.ઓ. ૩૧૬૬ દેશ

૦૫ સરનામાનું વિવરણ : ☐ ☐ ☐

સરનામાનો પ્રકાર ☐ નિવાસ ☐ વ્યવસાય ☐ પંજીકૃત કાર્યાલય ☐ અન્ય

સરનામું

શહેર/ગામ જિલ્લા

રાજ્ય પિન આય.એસ.ઓ. ૩૧૬૬ દેશ

૦૬ જોઆપેલ સરનામા પ્રમાણે વર્તમાન સરનામું નથી તો કૃપા કરી નીચે આપેલ દસ્તાવેજ આપો.

☐ ઉપભોક્તા બીલ ☐ પીપઓ / એફપીપીઓ ☐ પ્રોપર્ટી / મ્યુ. ટેક્સ બીલ

☐

દસ્તાવેજ ક્રમાંક તારીખ


ખોલવાની તારીખથી ત્રણ મહિનાની અંદર વર્તમાન સરનામા સાથે અધિકૃત રીતે માન્ય દસ્તાવેજ (OVD) જમા કરવાની મેં જાતે તારીખ લીધી છે.

૦૭ ઘોષણા સર્ક બાંધધરી સહ સ્વ પ્રમાણપત્ર

મેં / મને આપેલ ખાતુ ખોલવાના નિયમો અને શરતોની નકલ વાંચી, શરતો મને / અમને સમજાવવામાં આવી છે.

- ૧) હું જાહેર કરું છું કે મેં પીએમએલ એ ૨૦૦૨ મુજબ કેવાયસીના ધારાધોરણોનું પાલન કરવા / તેની ઓળખ કરવા પ્રમણિત યુઆઈડીએઈઆઈ દ્વારા પ્રાપ્ત આધાર કાર્ડ પ્રસ્તુત કરું છું.
- ૨) હું બેંકને સંમતિ આપું છું કે તે યુઆઈડીએઈઆઈ દ્વારા આપેલ આધાર કાર્ડની ચકાસણી કરી શકે છે અને બાયોમેટ્રિકના માધ્યમથી તેની ઓળખાણ કરી શકે છે.

હાં ☐ ના ☐



સ્થાન તારીખ :

૦૮ કાર્યાલયના ઉપયોગ માટે ☐ પ્રાપ્ત દસ્તાવેજ ☐ સ્વ પ્રમાણિત ☐ સત્ય પ્રતિ ☐ નોટરી

શું ખાતા ખોલવાની પ્રક્રિયાના હિસ્સામાં સ્વ પ્રમાણિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. હા / ના ફક્ત

પ્રમાણિત કર્યા બાદ શાખા દ્વારા ખાતુ ખોલવામાં આવશે.

પ્રમાણિત કરવામાં આવે છે કે ખાતાના સંચાલન મોટ અરજદારને નિયમો સમજાવવામાં આવ્યાં છે. (નિરક્ષર ખાતાદાર માટે ફરજિયાત)

જમા કર્તા નો પ્રકાર ☐ નિરક્ષર ☐ દિવ્યાંગ ☐ સ્ટાફ જોખીમ શ્રેણી : ☐ ઉચ્ચ ☐ મધ્યમ ☐ નિમ્ન

અધિકારી નામ પીએફ ક્રમાંક હોદ્દો

તારીખ એસએસનં. સહી

વ્યક્તિગત ખાતા ખોલવા માટેનું ફોર્મ (ભાગ-૧)

(બચત, ચાલુ ખાતા, કરંટ ખાતા (★) ભરવું જરૂરી છે. કૃપા કરી મોટા અક્ષરોમાં ભરો. સહી માટે કાળી શાહી નો ઉપયોગ કરો.)

(ખાલી કાર્યાલય ના ઉપયોગ માટે)

તારીખ

પ્રથમ અરજી કરનાર ગ્રાહકની આઈડી

બીજી અરજી કરનાર ગ્રાહકની આઈડી

ખાતા સંખ્યા

૦૧ ખાતાનો પ્રકાર

☐ બચત ખાતા ☐ બીએસબીડીએ ☐ બીએસબીડીએ લઘુ ખાતુ ☐ ચાલુ ખાતુ ☐ મિયાદી જમા / ફલેક્સી / આરડી ☐ કેપિટલ ગેન (એસબી)

૦૨ પરિચાલન નો તરીકો

☐ ☐ ☐ ☐ ☐ ☐

૦૩ અપેક્ષિત સેવાઓ

૧ એટીએમ સાથે ક્રેડિટ કાર્ડ

પ્રથમ અરજદાર ☐ હાં ☐ ના

બીજા અરજદાર ☐ હાં ☐ ના

કાર્ડ પર અપેક્ષિત નામ

૨ ચેક બુક ☐ હાં ☐ ના

૪ એસ.એમ.એસ. એલર્ટ
(પંજીકૃત મોબાઈલ નંબર ઉપર એસએમએસ એલર્ટ) ☐ હાં ☐ ના

૩ ઈન્ટરનેટ બેંકિંગ

લેવડ દેવડ અધિકાર અપેક્ષિત

પ્રથમ આવેદક ☐ હાં ☐ ના

બીજા આવેદક ☐ હાં ☐ ના

૫ ફોન બેંકિંગ ☐ હાં ☐ ના

૬ મોબાઈલ બેંકિંગ ☐ હાં ☐ ના

૭ પાસબુક અપેક્ષિત
(બચત ખાતા માટે) ☐ હાં ☐ ના

૮ ઈ સ્ટેટમેન્ટ () પેપર પ્રતિ ને બદલે ☐ અપેક્ષિત ☐ અપેક્ષિત નહિ

ફક્ત ઓપરેટર અને જોઈન્ટ ઓપરેટર એકાઉન્ટમાં જ લાગુ
અથવા સર્વિસ મોડ દ્વારા સંચાલિત જો એકાઉન્ટ નીચેની રીતે ચલાવવામાં આવે છે.
તો પ્રથમ અરજદારને ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા ઉપલબ્ધ થશે.

૦૪ ફિક્સ ડિપોઝિટ માટે

☐ ફિક્સ ડિપોઝિટ ☐ ફિક્સ ડિપોઝિટ (પુનઃ) ☐ વાર્ષિક થાપણ ☐ કર બચત યોજના ☐ કેપિટલ પેન

શાશ્વ. રૂા. _____ રૂા. (શબ્દોમાં) _____

સમય _____ વર્ષ _____ મહિનો _____ દિન _____

ફિક્સ ડિપોઝિટની સૂચનામાં વ્યાજ ☐ માસિક ☐ ત્રિમાસિક ☐ કેલેન્ડ ત્રિમાસિક ☐ છ માસ ☐ વાર્ષિક

પરિપક્વતાની સૂચના ☐ સ્વતઃ રિન્યુઅલ / રોકાણ વળતર ☐ ઓટો રિન્યુઅલ મુદ્દલ વ્યાજ

☐ મૂળ અને વ્યાજની ચૂકવણી ☐ રૂા. _____ આંશિક રકમ સાથે ઓટો રિન્યુઅલ

નવીનીકરણની તારીકે પ્રવર્તતા વ્યાજના દરે સમાન સમયગાળા માટે સ્વસંચાલિત નવીનીકરણ કરવામાં આવશે.

તમામ વ્યાજ ચૂકવવા પાત્ર અને પરિપક્વ સૂચના વિકલ્પો તમામ બેંકો દ્વારા ઓફર કરવામાં આવશે નહીં. વિકલ્પો માટે સંબંધિત બેંકનો સંપર્ક કરો.

મારા ખાતામાં કેડિટ દ્વારા ચૂકવણી સૂચનાઓ (પરિપક્વતા પ્રક્રિયા) ☐

બેંક ચેક / ડ્રાફ્ટથી ☐

નિરક્ષર થાપણદારોના કિસ્સામાં વિથ હોર્ડિંગ ઓફિસર દ્વારા પ્રમાણિત (નામ રિન્યુ કરવાની)	રોકડ અધિકારીની સહી
---	--------------------------

૦૫ બહુ વિકલ્પ જમા યોજના

☐ થાપણ પ્રકાર ☐ ફિક્સ ડિપોઝિટ ☐ ફિક્સ ડિપોઝિટ પુનઃ રોકાણ સમય _____ વર્ષ _____ માસ

અમે/હું સંમત છીએ કે સામાન્ય રીતે સેવિંગ્સ બેંક અને કરંટ એકાઉન્ટ પર લાગુ પડતા સર્વિસ ટેક્સ મારા/અમારા ખાતામાંથી ડેબિટ કરવામાં આવે. હું/અમે આથી મારા/અમારા બચત બેંક / કરંટ ખાતામાંથી
ડેબિટ કરવાની સંમતિ આપું છું. / આપીએ છીએ.

લિંક બચત બેંક / ચાલુ ખાતા નં.

☐

૦૬ ☐ રિકરિંગ ડિપોઝિટ ☐ ફલેક્સી ડિપોઝિટ

☐ માસિક હપ્તો _____ રૂપિયા શબ્દોમાં _____ સમય _____ વર્ષ _____ માસ

☐ સ્થાયી સૂચના જો કોઈ ડિબેટ એકાઉન્ટ ન હોય તો

☐ પાકતી મુદતે આ ખાતામાં જમા કરો

કૃપા કરીને ઉપરોક્ત ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ અહીં આપેલ બચત / ચાલુ ખાતામાંથી ટીડીએસ કાપો.
(સંયુક્ત ખાતાના કિસ્સામાં આવકવેરાની જોગવાઈઓ ફક્ત પ્રાથમિક/પ્રથમ ખાતા ધારકને લાગુ પડશે.)

નામાંકન વિવરણ

રજિસ્ટ્રેશન કંપાનિક

[illegible]

બેંક થાપણના સંદર્ભમાં અધિનિયમ ૧૯૪૯ની કલમ ૪૫૨ અને નિયમો ૧૯૮૫ હેઠળ નોમિનેશન

હું/અમે ----- નિમ્નાલિખિત વ્યક્તિનું નામંકન કરીએ છીએ જે / મારી મૃત્યુની સ્થિતિમાં

નીચે આપેલ વિવરણ મુજબ બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા પાછી આપવામાં આવે છે.

હું / અમે ઈચ્છુ છું / ઈચ્છીએ છીએ વારસદાર વ્યક્તિનું નામ પાસબુક પર છાપેલ હશે.

જમા નું વિવરણ

જમા નું પ્રકાર _____ ખાતા નં. _____

[illegible]

વારસદારની વિગત

૧૫૫

[illegible]

વારસદાર નો મોબાઈલ નં.

[illegible]

જમાકર્તા સાથે સંબંધ ----- ઉંમર ----- વર્ષ વારસદારની જન્મ તારીખ

[illegible]

વારસદાર સાથે સંબંધ, હું શ્રી / શ્રીમતી / કુમારી ----- ઉંમર ----- વર્ષ

સરનામું -----

ને મારી / વારસદાર ના મૃત્યુની સ્થિતિમાં જમા રાસિ રૂા. ને પ્રાપ્ત થાય તે માટે હું નિયુક્ત કરું છું.

અરજી કરનારની સહી / અંગૂઠાનું નિશાન	અરજી કરનારની સહી / અંગૂઠાનું નિશાન
પ્રથમ સાક્ષીની સહી	બીજા સાક્ષીની સહી
નામ સહી	નામ સહી
સરનામું	સરનામું

তারিখ								স্থান	
-------	--	--	--	--	--	--	--	-------	--

અરજી કરનારની સહી / અંગૂઠાનું ચિહ્ન	અરજી કરનારની સહી / અંગૂઠાનું ચિહ્ન
------------------------------------	------------------------------------

- ૧) હું/અમે ખાતા ખોલવાના નિયમો શરતો વાંચી છે. નિયમ અને શરતોની સ્પષ્ટતા અમને થઈ ગઈ છે અને તેનો હું/અમે સ્વીકાર કરીએ છીએ.
- ૨) (નાબાલિકનું ખાતું ખોલવા સંબંધિત)
- હું/અમે એ વાતની જાહેરાત કરું છું/કરીએ છીએ કે નાબાલિક જેના જન્મ તારીખ છે. જે મારા થાય. તેના તરફથી હું વિધિ માન્ય/પ્રાકૃતિક સંરક્ષક છું. મને ન્યાયાલયના આદેશ મુજબ તારીખ થી મારી નિયુક્તિ થઈ છે. (જેની પ્રતિતિથિ જોડેલ છે.) હું ઉપરોક્ત ખાતામાં વર્તમાન/ભવિષ્યમાં લેવળ દેવળ માટે નાબાલિકનું પ્રતિનિધિત્વ કરીશ. જ્યાં સુધી નાબાલિક વયસ્ક ન થાય ત્યાં સુધી હું ઉપરોક્ત નાબાલિકના દાવાના બદલામાં બેંકમાં તેના ખાતામાંથી જમા ઉધારની ક્ષતિપૂર્તિ માટે જવાબદાર રું.
- ૩) (સાવધિ (જોઈન્ટ એકાઉન્ટ) જમા ખાતા માટે લાગૂ ન હોય તો - કરો.)
- હું/અમે વચન આપું છું/આપીએ છીએ સાવધિમાં (જોઈન્ટ એકાઉન્ટ) બન્નેમાંથી એક પહેલો અરજદાર બીજા અરજદાર બન્નેમાંથી એકની કે બન્નેની મૃત્યુ થતા કાનુની ઉત્તરાધિકારીને મૃત્યુ પ્રમાણપત્ર પ્રસ્તુત કરતા એકનું નામ કમી/અને જીવિતને આપવાની અનુમતિ આપવામાં આવશે.
- ૪) હું/અમે જાહેર કરીએ છીએ કે હું/મારા અન્ય બેંકમાં બેઝિક બચત જમા ખાતું (બીએસબીડી ખાતા સંબંધિતમાં લાગુ) નથી.

સ્થળ :

તારીખ:

અરજદારની સહી / અંગૂઠાનું નિશાન	અરજદારની સહી / અંગૂઠાનું નિશાન
--------------------------------	--------------------------------

(ફક્ત કાર્યાલય ઉપયોગ હેતુ) ખાતું ખોલવા		નાની સહી	
તારીખ		(અધિકૃત અધિકારીની સહી)	
૧) ઈન્ટરનેટ બેંકિંગ (આઈએનબી) કિટ નં.			
૨) ઈન્ટરનેટ બેંકિંગ જોવા માટે અધિકાર	લેવાદેવાનું અધિકાર છે.		
૩) એટીએમ કાર્ડ મોકલવાની તારીખ			
૪) નામાંકન ક્રમાંક			
૫) કેવાયસી મર્યાદા			
૬) ફોન બેંકિંગ			
		ખાતા	
		સી.આઈ.એફ. લિંકિંગ	
		વેચકક્તિ ચેક	
		ઈન્ટરનેટ બેંકિંગ	
		મોબાઈલ બેંકિંગ	
		એસ.એમ.એસ. એલર્ટ	
		પ્રવિષ્ટિ દૂર કરવી	
		સ્કેનિંગ	